

નિબંધ તથા ચિત્રસ્પર્ધાનું આયોજન

➤ નિબંધ તથા ચિત્રસ્પર્ધાના વિષયો

- ૧ વર્તમાન સમયમાં સામાજિક સમરસતા
- ૨ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો એકાત્મ માનવવાદ
- ૩ સ્વચ્છતામાં પ્રભુતાનો ગાંધીસંદેશ
- ૪ સ્વચ્છભારત અભિયાન : પ્રયાણ અને પ્રાપ્તિ

- ખાસ નોંધ : બન્ને સ્પર્ધા માટે (અ) (બ) અને (ક) એમ દરેક વિભાગમાં વિષય સમાન રહેશે.

➤ નિબંધ સ્પર્ધાના નિયમો :

- (૧) નિબંધ સ્પર્ધા (અ) તથા (બ) એમ બે વિભાગમાં રહેશે.

‘અ’ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યમાં આવેલી સરકારમાન્ય ઉચ્ચશિક્ષણની તમામ વિદ્યાશાખાની કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. (અ) વિભાગના સ્પર્ધકો માટે નિબંધની શબ્દમર્યાદા ૧૫૦૦ શબ્દની રહેશે.

‘બ’ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યસરકાર માન્ય ઉચ્ચસ્તર માધ્યમિક શાળાના (ધો.૧૧ તથા ધો.૧૨)ના દરેક પ્રવાહના વિદ્યાર્થીઓ નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તેમના માટે નિબંધની શબ્દમર્યાદા ૧૦૦૦ શબ્દની રહેશે.

- (૨) નિબંધ ગુજરાતી તથા હિન્દીમાંથી કોઈ પણ એક ભાષામાં લખી શકાશે.

- (૩) નિબંધલેખન વિશે મૌલિકતાનું પ્રમાણપત્ર સાથે જ બિડાણ કરવું.

- (૪) યુનિવર્સિટી ખાતે નિબંધ મોકલવાની અંતિમ તારીખ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬ છે.

- (૫) દરેક નિબંધ મૂલ્યાંકન બાદ નોંધપાત્ર રીતે પ્રથમ પચાસ ક્રમમાં આવેલા નિબંધ સ્પર્ધકોને યુનિવર્સિટી દ્વારા અમદાવાદ મુકામે આમંત્રિત કરવામાં આવશે જ્યાં સ્પર્ધાના અંતિમ

તબક્કા સ્વરૂપે નિબંધલેખન કરવાનું રહેશે. અંતિમ તબક્કાના નિબંધોની સમીક્ષા બાદ બન્ને વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમાંકિત સ્પર્ધકોનું પરિણામ જાહેર થશે.

- (૬) નિબંધ ૧૪ પોઈન્ટ ફોન્ટ સાઈઝમાં કાગળની એકબાજુએ ટાઈપ કરેલો હોવો જરૂરી છે.
- (૭) નિબંધ ઉપર સ્પર્ધકે પોતાની ઓળખ પ્રગટ કરવાની નથી. માત્ર નિબંધના વિષય સિવાય કશું જ લખવાનું નથી.
- (૮) સ્પર્ધકે અલગ કાગળમાં આ મુજબ વિગતો લખવાની રહેશે : પોતાનું નામ, ઉંમર, અભ્યાસ, શાળા-કોલેજનું નામ, પત્રવ્યવહારનું સરનામું, ફોન નંબર તથા મેઈલ આઈ ડી.
- (૯) દરેક સ્પર્ધકે કવર ઉપર 'નિબંધ સ્પર્ધા' એમ અવશ્ય લખવાનું રહેશે. પ્રથમ દ્વિતીય, તૃતીય ક્રમાંકિત અ તથા બ એમ બન્ને વિભાગના સ્પર્ધકોને અનુક્રમે ૧૧૦૦૦, ૭૫૦૦, ૫૦૦૦ ના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
- નોંધપાત્ર દસ નિબંધોને દરેક સ્પર્ધક ઈઠ 'અ' તથા 'બ' એમ બન્ને વિભાગમાં ૧૧૦૦ રૂપિયાના રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવશે.
- (૧૦) સ્પર્ધા માટે સ્વીકૃત થયેલા દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
- નિબંધ કે ચિત્રરચના સાદી ટપાલ કે રજિસ્ટર્ડ પોસ્ટ કે કુરિયર કે રૂબરૂ યુનિવર્સિટીના અમદાવાદ સ્થિત સરનામે જમા કરાવી શકાશે.

: નિબંધ - ચિત્રરચના મોકલવાનું સરનામું :

ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

બાલાજી મંદિર સામે,

સરખેજ-ગાંધીનગર હાઈવે, છારોડી, અમદાવાદ-૩૮૨૪૮૧.

ચિત્ર સ્પર્ધા

ચિત્ર સ્પર્ધા (અ) (બ) (ક) એમ કુલ ત્રણ વિભાગમાં યોજાશે.

➤ 'અ' વિભાગમાં ગુજરાત રાજ્ય સરકારની માન્યતાપ્રાપ્ત ઉચ્ચશિક્ષણની તમામ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

'બ' વિભાગમાં ધોરણ ૯ થી લઈ ધોરણ ૧૨ સુધીના ગુજરાત રાજ્યની શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

'ક' વિભાગમાં ધોરણ ૫ થી લઈ ધોરણ ૮ સુધીના ગુજરાત રાજ્યની શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

- 'અ' 'બ' 'ક' એમ ત્રણેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંકે આવનાર દરેક સ્પર્ધકોને અનુક્રમે ૧૧૦૦૦/૭૫૦૦/૫૦૦૦ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
- 'અ' 'બ' 'ક' એમ ત્રણેય વિભાગમાં નોંધપાત્ર દસ-દસ-દસ, ચિત્રોને ૧૧૦૦/- રૂ. ના રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવશે.
- સ્પર્ધા માટે સ્વીકૃત ઠરેલ દરેક ચિત્રના સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે.
- ચિત્રની સાઈઝ ½ ઈમ્પિરીયલ રહેશે. (22" x 15")
- વોટર કલર, પોસ્ટર કલર અને ઓઈલ પેસ્ટલ – ત્રણ પૈકી કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકાશે.
- દરેક ચિત્ર સ્પર્ધકે કવર ઉપર 'ચિત્રસ્પર્ધા' એમ લખવું.
- દરેક ચિત્રના મૂલ્યાંકન બાદ 'અ' 'બ' 'ક' એમ ત્રણ વિભાગ પૈકી પ્રત્યેક વિભાગમાંથી પચાસ ચિત્ર સ્પર્ધકોને (કુલ ૧૫૦) અંતિમ તબક્કાની સ્પર્ધા માટે યુનિવર્સિટી દ્વારા અમદાવાદ મુકામે આમંત્રિત કરવામાં આવશે. સ્થળ ઉપરની ચિત્રસ્પર્ધામાં શ્રેષ્ઠ ત્રણ ક્રમાંકિત તથા દસ પ્રોત્સાહક સ્પર્ધકોનું પરિણામ મૂલ્યાંકન બાદ જાહેર કરવામાં આવશે.
- અ-બ-ક એમ ત્રણેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉપરાંત દસ-દસ પ્રોત્સાહન પુરસ્કાર મુજબ કુલ ૩૯ સ્પર્ધકોની આખરી પસંદગી પુરસ્કાર માટે થશે.